

Seat No. : _____

NC-102

November-2021

M.Com., Sem.-III

**503 : Financial Services
(New)**

Time : 2 Hours]

[Max. Marks : 50

- સૂચના : (1) વિભાગ-Iના તમામ પ્રશ્નો સરખાં ગુણ ધરાવે છે.
(2) વિભાગ-Iમાંથી કોઈપણ બે પ્રશ્નોના જવાબ લખો.
(3) વિભાગ-IIનો પ્રશ્ન નંબર 5 ફરજિયાત છે.

વિભાગ – I

1. (A) નાણાકીય સેવાઓ એટલે શું ? નાણાકીય સેવાઓ નાણાકીય વ્યવસ્થાનું અગત્યનું ઘટક કેવી રીતે છે તે સમજાવો. 10
(B) વેન્યર કેપીટલ એટલે શું ? વેન્યર કેપીટલ ધિરાણના તબક્કાઓ સમજાવો. 10
2. (A) વેપારી બેંક એટલે શું ? વેપારી બેંકની સેવાઓ અને ફરજો સમજાવો. 10
(B) ગૃહ ધિરાણ કંપનીઓ (HFC)ની બજાર વ્યૂહરચના સમજાવો. 10
3. (A) જીવન વીમો એટલે શું ? વિવિધ પ્રકારની જીવન વીમાની પોલિસીઓની સમજૂતી આપો. 10
(B) નિષ્ક્રિય અસ્ક્યામતો (NPA) એટલે શું ? તેનું (NPA) વર્ગીકરણ સમજાવો. 10
4. (A) મ્યૂચ્યુઅલ ફંડ એટલે શું ? મ્યૂચ્યુઅલ ફંડની યોજનાના પ્રકાર વિગતવાર સમજાવો. 10
(B) ટૂંકનોંધ લખો : “મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણના ફાયદા” 10

વિભાગ – II

5. યોગ્ય વિકલ્પ પસંદ કરો : (કોઈપણ પાંચ) 10
(1) કબજેદાર (custodian) તરીકે ‘સેબી’ સમક્ષ નોંધણી કરાવવા માટે કેટલી નોંધણી ફી ભરવી પડે છે ?
(A) ₹ 75,000 (B) ₹ 1,00,000
(C) ₹ 50,000 (D) ₹ 1,50,000
(2) ‘A’ શાખક્રમાંક એટલે શું ?
(A) પૂરતી સલામતી (B) ઊંચી સલામતી
(C) વધારે સલામતી (D) શ્રેષ્ઠ સલામતી

- (3) રિઝર્વ બેંક સૌપ્રથમ 1992માં કઈ બેંકને જસિ અંગે નાણાકીય સેવાની મંજૂરી આપી ?
 (A) એચ.ડી.એફ.સી. બેંક (B) એક્ઝીસ બેંક
 (C) સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક (D) કોર્પોરેશન બેંક
- (4) શેર ભરણાં માટે બેંકર તરફ પ્રવૃત્તિઓ કરવા માટે વેપારી બેંકે 'સેબી' પાસેથી કયું પ્રમાણપત્ર મેળવવું પડે છે ?
 (A) નોંધણીનું પ્રમાણપત્ર (B) સધ્ધરતાનું પ્રમાણપત્ર
 (C) માન્યતાનું પ્રમાણપત્ર (D) બેંક સ્થાપનાનું પ્રમાણપત્ર
- (5) ભારતમાં હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશનની સ્થાપના ક્યારે થઈ ?
 (A) ઈ.સ. 1975 (B) ઈ.સ. 1977
 (C) ઈ.સ. 1978 (D) ઈ.સ. 1974
- (6) હાલની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું નામ શરૂઆતમાં કયું હતું ?
 (A) સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (B) હિન્દુસ્તાન બેંક
 (C) ઈમ્પિરિયલ બેંક ઓફ ઈન્ડિયા (D) ભારતીય ફાઇનાન્સ બેંક
- (7) ખાનગીક્ષેત્રે સ્થપાયેલ સાત નવી બેંકોમાં છેલ્લે 2004માં કઈ બેંક સ્થપાઈ ?
 (A) ડેવલપમેન્ટ ક્રેડિટ બેંક (B) યશ બેંક
 (C) કોટક મહિન્દ્રા બેંક (D) એચ.ડી.એફ.સી. બેંક
- (8) વીમો એટલે
 (A) બે પક્ષકારો વચ્ચે મૌખિક કરાર (B) બે પક્ષકારો વચ્ચે મૌખિક લેવડ-દેવડ
 (C) બે પક્ષકારો વચ્ચે લેખિત કરાર (D) બે પક્ષકારો વચ્ચે સોદા અંગેનો કરાર
- (9) મ્યુચ્યુઅલ ફંડની પદ્ધતિસરની રોકાણ યોજના એટલે
 (A) સાવચેતીપૂર્વક રોકાણ (B) મધ્યમ પ્રકારનું રોકાણ
 (C) બજારની તકો પ્રમાણે રોકાણ (D) ચોક્કસ રકમનું સમયાંતરે રોકાણ
- (10) સૌપ્રથમ ભારતમાં યુનિટ ટ્રસ્ટ દ્વારા વિદેશમાં ઢાખલ થયેલ મ્યુચ્યુઅલ ફંડનું નામ શું હતું ?
 (A) યુ.ટી.આઈ. ફંડ (B) ઈન્ડિયા ફંડ
 (C) હિન્દુસ્તાન ફંડ (D) બેસ્ટ ઈન્ડિયા ફંડ

Seat No. : _____

NC-102

November-2021

M.Com., Sem.-III

**503 : Financial Services
(New)**

Time : 2 Hours]

[Max. Marks : 50

- Instructions :** (1) All Questions in **Section – I** carry equal marks.
(2) Attempt any **TWO** questions in **Section – I**.
(3) Question No. – **5** in **Section – II** is **COMPULSORY**.

Section – I

1. (A) What is Financial Services ? Explain how Financial Service is an important component of Financial System. **10**
(B) What is Venture capital ? Explain the stages of Venture capital lending ? **10**
2. (A) What is Merchant Bank ? Explain the services and duties of Merchant Bank. **10**
(B) Explain Marketing strategies of Housing Finance companies. **10**
3. (A) What is Life Insurance ? Explain the different types of Life Insurance Policies. **10**
(B) What is Non-Performing Assets (NPA) ? Explain the classification of Non-performing Assets. **10**
4. (A) What are Mutual Funds ? Explain various types of Mutual Fund schemes in brief. **10**
(B) Write short note : Advantages of investment in Mutual Funds. **10**

Section – II

5. Choose correct option : (any **five**) **10**
 - (1) How much registration fee is required to pay to 'SEBI' for the registration as custodian ?
(A) ₹ 75,000 (B) ₹ 1,00,000
(C) ₹ 50,000 (D) ₹ 1,50,000
 - (2) What is 'A' Credit Rating ?
(A) Enough safety (B) High safety
(C) More safety (D) Best safety

- (3) Which bank is given first approval for forfeiting financial service by R.B.I. in 1992 ?
(A) HDFC Bank (B) AXIS Bank
(C) Standard Chartered Bank (D) Corporation Bank
- (4) To act as a banker for public issue of shares, which certificate bank has to obtain from SEBI ?
(A) Certificate of Registration (B) Solvency Certificate
(C) Approval Certificate (D) Bank Establishment Certificate
- (5) When the Housing Development Finance Corporation was established in India ?
(A) 1975 (B) 1977
(C) 1978 (D) 1974
- (6) What was the initial name of present State Bank of India ?
(A) Central Bank of India (B) Hindustan Bank
(C) Imperial Bank of India (D) Indian Financial Bank
- (7) Out of seven newly established banks in Private sector, which bank was established in the year 2004 ?
(A) Development Credit Bank (B) Yes Bank
(C) Kotak Mahindra Bank (D) HDFC Bank Ltd.
- (8) Insurance is
(A) Oral contract between two parties.
(B) Oral exchange between two parties.
(C) Written contract between two parties.
(D) Contract of negotiation between two parties.
- (9) Systematic Investment Scheme of Mutual Fund means,
(A) Careful investment
(B) Medium type investment
(C) Investment considering opportunity
(D) Periodically specified investment
- (10) What was the name of first Mutual Fund started in Foreign country by Unit Trust of India ?
(A) UTI Fund (B) India Fund
(C) Hindustan Fund (D) Best India Fund
-